

Oil & Gas Field Services

October 29, 2024

To, Corporate Relations Department BSE Limited 2nd Floor, P.J. Towers,

Dalal Street, Mumbai – 400 001 To, Corporate Relations Department National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C-1, Block-G, Bandra Kurla Complex, Bandra (East),

SCRIP CODE: 543288

SYMBOL: DEEPINDS

Mumbai - 400 051.

Sub.: Newspaper Publication of Financial Results - Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

In compliance with Regulation 47 and other applicable provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of newspapers advertisement published on Tuesday, October 29, 2024 in Business Standard (English) and Jai Hind (Gujarati) editions wherein the unaudited standalone and consolidated Financial Results of the Company for the quarter and half year ended on September 30, 2024 as approved by the Board of Directors of the Company have been published.

This intimation will also be uploaded on the Company's website at www.deepindustries.com.

You are requested to take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Deep Industries Limited

Shilpa Sharma

Company Secretary & Compliance Officer

M.No: A34516

Encl.: a/a





Regd.Off.: 12A & 14 Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad-380058
Tel: +91 2717 298510 M: +91 98256 00533 Fax: +91 2717 298520
Email: info@deepindustries.com Website: www.deepindustries.com
CIN: L14292GJ2006PLC049371





JHADESHWAR VILLAGE BRANCH: 7,8,9 R.K. Avenue, At. Post Jhadeshwar, Shukalfirth Road, Jhadeshwar Chokdi Dist. Bharuch Mob No: 9099060836

POSSESSION NOTICE (Immovable Property)

It all of the constraints are secretary and the constraints and the constraints are secretary as a secretary lateral forcements place (200 Issued a denominal notice date). Calling upon the borrower Mr. Avatarsinia Dharamsinia Rajpur - (Borrower) A retartsinia Rajpur - (Borrower) A retartsinia Rajpur - (Borrower) A retartsinia Rajpur - (Borrower) and A retartsinia Rajpur - (Borrower) and A retartsinia Rajpur - (Borrower) and the statistical Rajpur - (Borrower) by 10 to repay the annount mentioned in the notice being Rs. 3.25, 187.78 (Rayee interpretary) by 200 retartsing the constraints and the statistical Rajpur - (Borrower) and the constraints are second to the constraints and the constraints are second to the constraints and the constraints are second to the constraints and constraints are second to the constraints and the constraints are second to the constraints are second to the constraints and the constraints are second to the constraints are second to the constraints and the constraints are second to the constraints and the constraints are second to the constraints are second to the constraints and the constraints are sec

on is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in

available, to redeem the socured assets.
In particular and the public in general is hereby cautioned not to deal with the ny dealings with the property will be subject to the charge of Bank of Banda (llage branch, Bharuch for an amount of Rs. 9.25.187.79 (Rupees Nine Lakh housand One Hundred Eighty Seven and Paise Seven Nine Only) and

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY war, at Registration & Sub District Braruch , District B roperty is as under:-East- House of Mohanbhai Maganbhai, Wei

Road.
Chief Manger & Authorised O
Bank Of Ba

DEBTS RECOVERY TRIBUNAL-I

(Ministry of Finance, Government of India)
2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram,
Paldi, Ashram Road, Ahmedabad - 380006.

u/s. 3 of the Recovery of Debts due to Banks & Financial Institutions Act, 1993 fr mprising, Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan, Sabarkanth pages, Banaskantha (Balancurk of Guizert State us 6, 1 ft June 2007).

(minima-reaga), parassama (reagan) of roughat same well. I Sun Outward No. 1998/2024 O. A. No. 347/2023 PUNJAB NATIONAL BANK & ORS VERSUS W/S. SHRENIK LTD & ORS Exh. No. 16 . DEFENDANTS PUBLIC SUMMONS

TO,

(6) MR SURESHKUMAR AMULAKH SHAH A-91, PRISIMA BUILDING, C G ROAD,
NAVRANGPURA, AHMEDABAD-380009.

ALSO AT: 903, SAMPRAT, B/H. SHARDA PETROL PUMP, JUDGES BUNGLOW ROAD,

(?) MR RATANIAL HANUMANIAL BOTHRA 27/2, NUTAN CLOTH MARKET, NR ANKUR MILL OITSIDE RAIPUR, GATE, KANKARIA, AHMEDABAD-380054.

OUTSDE PARPIE, CATE, KANAGARA, A-MECHARO, SUBDOS.

WHEREAS In above named Appicant/Appellant has filed the above referred

WHEREAS in above named Appicant/Appellant has filed the above referred

WHEREAS in above named a Summors could not be effected in the ordinary manner and

whereas the application for solidations shortly has been allowed by this Thomas.

Now are directed apage before this Tournain in person or mining in Androscae and file

Within Statement's you or 8.1 - 1.024 at 10.30 a.m. and show cause as to why reliefs proyed

for should not be granted.

Take notice that, in default of, the Application/Appeal shall be heard and decided in your

Answerper

SEAL

PUBLIC NOTICE PICICI Bank | Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Wagle Industrial Estate, Thone (West)- 400604

e following barrower(s) has/have defaulted in the repayment of principal and interest towards the Loan facility(ies ailed from ICICI Bank. The Loan(s) has/have been classified as Non-Performing Asset(s) (NPA). obtained to them under Section 132) of the Securitisation and Re-construction of Financial Assets and Enforcement curity interest Act, 2002, at their last known addresses. However, it has not been served and are therefore being notified by way of Public Notice.

Name of the Borrower/ Co-Borrower/Guarantor/ (Loan Account Number) & Address	Description of Secured Asset to be enforced	Date of Notice sent/ Outstanding as on Date of Notice	Date
M/s. JMR Impex/ Mr. Rahul Mukeshkumar Rangrej/ Mrs. Matiry Rahul Rangrej/ Mrs. Jaynaben Mukesh Rangrej/ 1/21705000485 & 121755000033/ 06/2119, Ground Floor, Limbu Sheri, Near Swaminarayan Temple, Rampura, Mahidharpura, Gujarat Surat- 395003	Property Premises of City Survey Nondh No. 2119, at Limbu Sheri, Mahidharpura of Nondh No. 2119 of Ward No. 6. Taluka Surat City, District Surat, Gujarat Including Current Assets & Receivables	October 15, 2024 Rs. 1,98,77,218.25/-	02/11/ 2024
M/s. Shubham Embro/ Mr. Lalitkumar Gothi S/o. of Mr. Harakchand Gothi/ Mrs. Leeladevi Mr. Harakchand Gothi/ Mrs. Leeladevi Harakchand Gothi/ Mrs. Manisha Lalitkumar Gothi/ 005205008150/ 201-202, Icon Textiles Hub, Near Sai Khati, Market Ring Road, Gujarat Surat- 395002	Flat No. F-1-A. First Floor, Poddar Residency, Building No. F. Constructed on Revenue Survey No. 81/1 Block No. 177, Revenue Survey No. 86/1- Block No. 186, Revenue Survey No. 77/3 Block No. 114, T. P. Scheme No. 13 (Bhorthana-Vesu), Old Final Plat No. 85, 88 98. 92, New Final Plat No. 79, 83, 86, Moje Bharthana - Vesu, City Surat, Registration Sub-District & District Surat, Gujarat	October 15, 2024 Rs. 16,04,399.00/-	28/05/ 2024
Mr. Banwarilal Devilal Mandoriya/ Mrs. Suman Mandoriya/ 085605001890/ Flat No. 204, 2nd Floor, Metro Appartment, Mahalaxmi Nagar, Behind Kotak Mahindra Bank Daman-Vapi Road, Chala Pardi, Valsad-396195	Flot No. 204. 2nd Floor, Metro Appartment Constructed on Lund Bearing Revenue Survey No. 334/A1/ Poliki-334/A1/, Poliki-337/A1/, Plot No. 49, New Revenue Survey No. 334/A/337/A Plot 49Pcikl2. & 334/A/337/A Plot 49Pcikl01. Consoldioted Block No. 2490, 2491 of Village Chola, Registration Sub-District & Taluko Pardi, Registration District Valsaci.	October 11, 2024 Rs. 17,37,543.21/-	02/08/ 2024
	Co-Borroweri/Guiorantor/ (Loan Account Number) & Addressum are Account Number) & Addressum are Rangely Mes. Mally Rohul Rangely Mes. Mally Rohul Rangely Mes. Mally Rohul Rangely Mes. 2012.19.600.033 (2012).600.033 (2	Co-Borrower(Guarantari (Loan Account Number) & Addresses Ms. JMR Impact Mr. Rohul Makeshkums Rompgl Mns. Mns. Rohul Mns. 2119. Perperty Premises of City Survey Nondh No. 2119. Rowal No. 5. Tolkin Surre City, District Surre City, District Survey No. 2119. Rowal No. 5. Makes Surre City, District Survey No. Rohul No. 2119. Rowal No. 5. Makes Surre City, District Survey No. Rohul No. 2119. Rowal No. 5. Mns. Surre City, District Survey No. 2119. Rowal No. 5. Mns. Survey No. 100. Rowal No. 5. Mns. No. 10	Co-Borrower/Guarontor/ (Load Account Number) & Address MS_JMR Impoz M. Rathul Mukeshkuma Rangely Ms. Maltry Rohal Kangary Ms. Ms. Shubhar Embrov Mr. Lalitkumir Colh Ms.

These steps are being taken for substituted service of Notice. The above borrower/s and/or guarantor/s (as applicable) is/are advise o make the outstanding payment within 60 days from the date of publishing this Notice. Else, further steps will be taken as per th provisions of the Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Date: October 29, 2024 Place: Surat



DEBTS RECOVERY TRIBUNAL - I

(Ministry of Finance, Department of Financial Service, Government of India)
4th Floor, Bhikhubhai Chamber" Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad - 380 006

Form No. 22 (Earlier 62) [Regulation 37(1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961]

E-AUCTION/SALE NOTICE THROUGH REGD. AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM

PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

C.H.: PUNJAB NATIONAL BANK VERSUS **C.D.: CHIRANJEEV PRINTERS**

R.C. No. 173/2018 O.A. NO. 520/2016

CD No. 1: M/s. Chiranjeev Printers, A Proprietorship firm through its Proprietor Mr. Dakshesh Bhadrakumar Dave.
12, Maulik Apartment, New Sharda Mandir Road, Sukhipura, Paldi, Ahmedabad - 380007. Also at: M/s. Chiranjeev Printers, E/1 and E/14, B/M, G/F, F/F, New Madhavpura Market, Shahibaug, Ahmedabad. Also at: A/14, Pushpraj Industrial Estate, Bapunagar, Anii Starch Road, Ahmedabad.

The under mentioned property will be sold by Public e-auction Sale on 12th December, 2024 for recovery of sum of Rs. 42,57,806.00 (Rs. Forty Two Lakhs Fifty Seven Thousand Eight Hundred Six Only) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-11 (Is as anymut elbeat/unconseed if Join from Mic Chipriage Professer

ı	1, (LC	(Coss amount an easy recovered, if any), nontring over 1 miles.					
ı	Description of Property						
Lot Description of the property to be sold with the names of the co-owners where to No. property belongs to defaulter and any other person as co-owners		Description of the property to be sold with the names of the co-owners where the property belongs to defaulter and any other person as co-owners	Reserve Price below which the property will not be sold	EMD 10% of Reserve Price/ Rounded off			
l	1	All the piece and parcel of Immovable Property being Plot No. E-510, Admeasuring about 2000.00 Sq. Mtrs., G.I.D.C., Sanand-II, Taluka Sanand, Dist. Ahmedabad.	Rs. 59.50.000.00	Rs. 5.95,000.00			

Revenue assessed upon the property or any part thereof: Not Kno Details of any other encumbrance to which property is liable: Not Kn

Valuation Also state Valuation given, if any by the Certificate Debtor: No Claims, if any which have been put forward to the property & any other known particulars being its nature & value: Not Know

latins, if any which have been put forward to the property & any other known particulars being its nature & value: Not Known
A Judion i bidding shall only be through online electronic mode through the eauction website is. https://www.ethzray.org/ The intending bidders should register the participation with the service provider-well in advance and get user ID and password for participating in E-auction. I can be procured only when the requisite earnest more; be deposited in prescribed mode below.

EMD shall be deposited by lasted by till 4:00 PM on 10.12.2024 in eBKray wallet through e-auction website i.e. https://www.ebkray.in EMD deposite hereafter shall not be considered for participation in the e-auction.

In addition to above, the copy of PAN Card, Address Proof and Identity Proof. E-mail ID. Mobile Number, in case of the company, copy of board resolution passes the Board of Directors of the company or any other document confirming representation/attoracy of the company and the Receipt/Duratter File of such deposites the Board of Directors of the company or any other document confirming representation/attoracy of the company and the Receipt/Duratter File of such deposites the Board of Directors of the company or any other document confirming representation/attoracy of the company and the Receipt/Duratter File of such deposites the Board of Directors of the company or any other document confirming representation/attoracy of the company and the Receipt/Duratter File of such deposites through the same mode of payment.

EMD separate company and the same mode of payment.

	Name of Auction Agency	PSB Alliance (Ebkray E-Auction Portal)				
Address Unit 1, 3rd Floor, VIOS Commercial Tower, Nr. Wadala Truck Terminal, Wadala East, N						
	Helpline No.	+91 8291220220				
	Web Site Address & Email Address	Website: https://www.ebkray.in Email: psba@psballiance.com				
	Bank Officer	Mrs. Suman Mittal, Mobile: +91 9861223264, Email: cs4517@pnb.co.in				

- Prospective bidders are advised to visit website https://www.ebkray.in for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
 The property shall not be sold below the reserve price.
 The property shall not be sold below the reserve price.
 The property shall not be sold in 01 for, with Reserve Price as mentioned above lot.
 The bidder shall be sold in 10 for white Reserve Price as mentioned above lot.
 The property shall be sold "AS IS WHERE IS ASIS, and shall be subject to other terms and conditions as published on the official website of the e-auction agency.
 The highest bidder shall have to depoint 25% of this final bid amount after adjustment of EMD already paid, by immediate next bank working day by 4:00 P.M. through RTGS/NEFT in the account as mentioned hereunder;

Beneficiary Bank Name	Punjab National Bank		
Beneficiary Name:	Sundry, NPA, SARFAESI, Auction related		
Beneficiary Account No.:	451700317118A		
IFSC Code:	PUNB0451700		
Branch:	Circle SASTRA, Ahmedabad		

- Branch: Crole SASTRA, Ahmedabad
 The successful bidderlaction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property
 If the 15th day is Sunday or other Holiday, then on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the
 above, the purchaser shall also deposit poundage lee (gi % on total sale consideration money (plus Rs.10) through DD in four our of The Registrar (DAAhmedabad. The DD prepared towards poundage's fees shall be submitted directly with the office of Recovery Officer4, DRT-I, Ahmedabad.
 In case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thinks fit, be forfielded to
 Covernment Account and the defaulting purchaser shall fortified all dains to the property or the amount deposted. The property shall be resold for which it is used or fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is used security or the property or the amount of the price for which it is used resolvently sold.
- issued on less procenification to start. Future in the processes issue about insule ground any structure of unimensure travellar in its about an including and in the which it is subsequently sold.

 14. The Successful bidder should note that TDS and GST liability, if any, arising out of sale of properties will have to be borne by the successful bidder separately over and above the sale consideration amount and shall not be deducted from sale consideration amount confirmed by this forum.

 15. Schedule of auction is as under:

Date and Time of Inspection	27.11.2024	Between 2.00 pm to 4.00 pm
Date of uploading proof of EMD / Documents on the e-acution Website	10.12.2024	Upto 4.00 pm
Last date of submissions of hard copies of proof of EMD/documents with office of the Recovery Officer-I	10.12.2024	Up to 5:00 pm
Date and Time of E-Auction:	12.12.2024	Between 12.00 Noon to 1.00 pm (with auto extension clause of 5 minutes, till auction completes.)

16. The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postp one or cancel the e-auction without assigning any reas



DEEP INDUSTRIES LIMITED

Registered Address: 12A & 14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad – 380 058

Ph.: 02717-298510 • Fax: 02717-298520 • E-mail: cs@depoindustries.com • Website: www.depoindustri

EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS

	FOR THE QUARTER AND HALF TEAR ENDED ON 30 SEPTE	WBER 2024	(< 11	Lakris except	per snare data)
Sr			R ENDED	HALF YEAR ENDED	YEAR ENDED
No		30-9-2024	30-9-2023	30-9-2024	31-3-2024
1		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations (net)	13,773.12	11,098.22	27,203.49	46,262.58
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	5,129.17	3,793.64	10,038.93	15,220.65
3	3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional items) 4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)		3,793.64	10,038.93	15,378.70
4			2,952.33	8,028.89	12,515.93
5	Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss)	4,206.24	3,111.14	8,092.12	12,573.41
1	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]				
6	Equity Share Capital (Face Value of ₹. 5/- per share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity	-	-	-	141,125.40
8	Earning per share of ₹. 5/- each				
1	(from Continuing and Discontinuing Operations)				
1	Basic (in ₹.)		4.61	11.79	19.56
	Diluted (in ₹.)	6.00	4.61	11.79	19.56

The above consolidated financial results of Deep Industries Limited, its subsidiary have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28" October 2024. The statutory auditor have carried out Limited Review of above consolidated financial results of the Company.

KEY STANALONE FINANCIAL INFORMATION IS GIVEN BELOW:

	Lakhs except	
IDED	HALF YEAR	YEAR ENDE

Sr No		QUARTER ENDED		HALF YEAR ENDED	YEAR ENDED
	Particulars	30-6-2024	30-6-2023	30-9-2024	31-3-2024
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations (net)	11,898.37	9,577.93	23,862.71	40,787.06
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	3,995.55	3,205.09	8,005.50	13,719.13
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,995.55	3,205.09	8,005.50	13,719.13
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,979.31	2,398.43	6,017.32	10,425.23
5	Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss)	2,979.31	2,398.43	6,017.32	10,426.95
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]				
6	Equity Share Capital (Face Value of ₹. 5/- per share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity	-	-	-	122,435.85
8	Earning per share of ₹. 5/- each				
	(from Continuing and Discontinuing Operations)				
	Basic (in ₹.)	4.65	3.75	9.40	16.29
	Diluted (in ₹.)	4.65	3.75	9.40	16.29

- The above standalone financial results of Deep Industries Limited have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28" October, 2024. The statutory auditor have carried out Limited Review of above standalone financial results of the Company.
- Internacial results of the Company.

 2. The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and half year ended 30° September, 2024 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.deepindustries.com).

 On behalf of Board of Directors

On behalf of Board of Directors Paras Shantilal Savia Chairman & Managing Director - DIN:00145639

Place : Ahmedabad Date : 28-10-2024



DEBTS RECOVERY TRIBUNAL - I

(Ministry of Finance, Department of Financial Service, Government of India)
4th Floor, "Bhikhubhai Chamber" Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad - 380 006

Form No. 22 (Earlier 62) [Regulation 37(1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961]

E-AUCTION/SALE NOTICE THROUGH REGD. AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM

PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

C.H.: PUNJAB NATIONAL BANK VERSUS C.D.: SHIV APPARELS & ORS.

R.C. No. 375/2019 O.A. NO. 620/2015

CO No. 1: M/s. Shiv Apparels, A Partnership Firm: C-26-A, Shrinath Estate, Nr. Ghanti Stop, Rabari Colony, Amraiwadi, Ahmedabad - 380026. CD No. 2: Mr. Ashokbhai Khemabhai Makwana: 240, Bhikha Deva No Vado, B/h. Amraiwadi Police Chowky, Amraiwadi, Ahmedabad - 380026. CD No. 3: Mr. Mahadevbhai Pundalik Shinde:

Flat No. A/112, Umang Narol-2, Nr. Fire Pack Insulators Pvt. Ltd., Nr. Hi-Fi 25, Narol Gam, Ahmedabad

CD No. 4: Ishwarbhai A. Solanki: 87, Ishanand Society, Inside Praduman Society, Nr. Sindhwai Mata Mandir, CTM-Ramol Road, Ahmedabad.

CD No. 5: Konica Manoj Das (Alias Konica Abhijit Haldhar):
12, Shawil Avenue, Maniyasa, Nr. Under Bridge, Maninagar (East), Ahmedabad - 380008.
CD No. 6: Kiranben Ashokbhai Makwana: 661, Bharti Nagar, Agarwal Compound, Amraiwadi, Ahmedabad - 380026.
CD No. 7: Ranjanben Manubhai Chavda: B-1/22M, 2nd Floor, Shaara-3, Nr. Awadh Apartment, Vatva Road, Ahmedabad.

The under mentioned property will be sold by Public e-auction Sale on 18th Day of December, 2024 for recovery of sum of Rs. 64,08,174.00 (Rs. Sixty Four Lakhs Eight Thousand One Hundred Seventy Four Only) (as per interest Certificate) plus interest and cost payable as per Recovery Certificate issued by Honble Fresding Officer, Puffer, (Less amount laready recovered, (lary), from Ms. Shiv Appares & Ox.

	Description of Property						
Lot No.		Reserve Price below which the property will not be sold	EMD 10% of Reserve Price/ Rounded off				
1	Flat No. 22, Second Floor, adm. 636 Sq. Ft. i.e. 59.09 Sq. Mtrs. in Shan-3 constructed on the land bearing Revenue Survey No. 1410¹ and 14102, TP Scheme No. 128, FP No. 327, Mouje Vatva, Taluka City East, Registration Disk Ahmedabad and Sub-Disk Ahmedabad-(Narol), New 5.00 bits Ahmedabad-11 (Aslati). Bounded by: East: Flat No. B1/23, West: Open Place, North: Open Place, South: Flat No. B1/21.	22,60,000.00	Rs. 2,26,000.00				

Revenue assessed upon the property or any part thereof: Not Known
Details of any other encumbrance to which property is liable: Not Known
Valuation Also state Valuation given, if any by the Certificate Debtor: No
Claims, if any which have been put forward to the property & any other known particulars being its nature & value: Not Known

Auction / bidding shall only be through online electronic mode through the e-auction website i.e. https://www.ebkray.in

The intending bidders should register the participation with the service provider-well in advance and get user ID and password for participating in E-auction.

- The menoing booters should register the participation with mis service provider-well in advance and get use for land password to practicipating in E-auction. It is can be proused only when the requisite earnest money is deposited in prescribed mode below.

 END shall be deposited by lasted by till 4:00 PM on 16.12.2024 in eBKray wallet through e-auction website i.e. https://www.ebkray.in EMD deposited threesfater shall not be considered for participation in the e-auction. Proof. E-mail ID, Mobile Number, in case of the company, copy of board resolution passed by the Board of Directors of the company or any other document confirming representation/attorney of the company and the Receipt/Counter File of such deposit should reach to the said service provider through e-auction website by uploading soft copies on to before till 4:09 pm on 16.12.2024 and also hard copies alongwith EMDs deposit receipts should reach the Office of Recomptory Officer-I, DRTI-A, Ahmedabad by 1:12.2024, it is also held that earnest money of unsuccessful bidders shall be returned back in the respective accounts such bidders through e-auction website through the same mode of payment.

 Prosecutely bidder are wave all online training from service provider:

Toopostro blada may aran omino saming nom our not promote.					
Name of Auction Agency	PSB Alliance (Ebkray E-Auction Portal)				
Address	Unit 1, 3rd Floor, VIOS Commercial Tower, Nr. Wadala Truck Terminal, Wadala East, Mumbai-400037				
Helpline No.	+91 8291220220				
Web Site Address & Email Address	Website: https://www.ebkray.in Email: psba@psballiance.com				
Bank Officer	Mr. Ankur Shivastav, Mobile: +91 9540198443, Email: cs4517@pnb.co.in				

- Prospective bidders are advised to visit website https://www.ebkray.in for detailed terms & conditions and procedure of sale before submitting their bids. The properly shall not be sold below the reserve price. The properly shall be sold in 10 to 10 with Reserve Price as mentioned above lot. The bidder shall improve offer in multiples of Rs. 10,000- for lot no. 1 during entire auction proid. The properly shall be sold "As IS WHEREER IS ASIS" and shall be shalled not have trans and nondifience as enablished on the official unbested of the auction of the property shall be shalled not have trans and nondifience as enablished on the official unbested on the property shall be shalled not have trans and nondifience as enablished on the official unbested on the property shall be shalled not have trans and nondifience as enablished on the official unbested on the property shall be shalled not have trans and nondifience as enablished on the official unbested on the property shall be shalled not have trans and nondifience as enablished on the official unbested on the property shall be shalled not not be reserved.

	through RTGS/NEFT in the account as mentioned hereunder;							
	. The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid, by immediate next bank working day by 4:00 F							
U.	. The property snaii	De Sold "A3 13	WHERE IS DASI	and shall be subject to other terms and conditions as published on the ollicial website of the	ie e-auction agency.			

- Beneficiary Account No.: 451 IFSC Code: PUNB0451700 Circle SASTRA, Ahmedabad
- Enanch: Cricle SASTRA Ahmedabad

 The successful bidder/auction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property.

 If the 15th day is Sunday or other Holiday, then on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above, the purchaser shall also deposit poundage fee @1% on total sale consideration money (plus Rs. 10) through DD in favour of The Registrar, DRT4.

 Ahmedabad. The DD prepared towns for poundage is Resealable submitted directly with the office of Recovery Officer, DRT4. Ahmedabad. The Abmedabad. The DD prepared towns for poundage is Resealable submitted directly with the office of Recovery Officer, DRT4. Ahmediabad. The Control of the Sale of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thins it, the forfield to the Coverment Account and the defaulting purchaser shall forfiel at claims to the property or the amount deposited. The property shall be resided for think, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which his new forces and the sale of the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which his new forces and the sale of the property of the amount deposited. The property shall be resided for the property of the amount deposited. The property shall be resided for the property of the amount deposited. The property shall be resided for the property of the amount deposited. The property shall be resided for the property shall be resided for the property of the amount deposited. The property shall be resided for the property shall be re
- solved in test procuration for sear. Furtine or procures as said analyse industry of said or any structure or unineable centered in said an order which it is subsequently sold.

 14. The Successful blocker of the Successful blocker of the Successful blocker or the Successful blo

15	Schedule of auction is as under:-								
ſ	Date and Time of Inspection	03.12.2024	Between 2.00 pm to 4.00 pm						
ſ	Date of uploading proof of EMD / Documents on the e-acution Website	16.12.2024	Upto 4.00 pm						
ſ	Last date of submissions of hard copies of proof of EMD/documents with office of the Recovery Officer-I	16.12.2024	Up to 5:00 pm						
ſ	Date and Time of E-Auction:	18.12.2024	Between 12.00 Noon to 1.00 pm (with auto extension clause of 5 minutes, till auction completes.)						



બલોચપુર પ્રાથમિક શાળાના શિક્ષકનો વયનિવૃતી સમારોહ યોજાયો હતો.(તસ્વીર : ગજુભા વાઘેલા - કાંકરેજ)

કાંકરેજ તાલુકાના

બલોચપુર પ્રાથમિક શાળાના શિક્ષકનો વયનિવૃતિ અને સત્કાર સમારોહ યોજાયો

કાંકરેજ, તા.૨૮ કાંકરેજ તાલુકાના ડુંગરાસણના વતની છેલ્લા ૯ વર્ષથી બલોચપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતાં સબાજી મકવાશાનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા

શાળા અને ગ્રામજનો માર્ગદર્શક સરસ્વતીના ઉપાસક અને પ્રજ્ઞાવાન તથા પરમ વંદનીય એવા

મકવાણા સુબાજી લેરાજી (ઠાકોર) તા. ૩૧/૧૦/૨૦૨૪ના રોજ વય નિવૃત થતા કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષક સુબાજીનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો હતો.

બાળાઓએ સ્વાગતગીત અને આચાર્યએ મહેમાનોને આવકાર્યા હતા. કાંકરેજ તાલુકા પૂર્વ પ્રમુખ વરધીજી ઠાકોર, બનાસકાંઠા શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમાલભાઈ જોષી વગેરે હાજર રહ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થિનીઓએ વયનિવૃત શિક્ષકના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શૈલેષભાઈ દેવ વગેરેએ કર્યું હતુ.

ચાકુની અણીએ મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી

અંકલેશ્વરમાં રેલવેના પાટા પાસે યુવાનને આંતરી લૂંટ કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વરના ગડખોલ થી છે. રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી મોબાઈલ અને ३पियानी लूंट यलावनार उ

અંકલેશ્વરના ગડખોલ ગામની રચના નગરમાં રહેતા વિપુલ સાટીયા બે દિવસ પૂર્વે અંકલેશ્વર થી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન અચાનક ગયો હતો ત્યારે રેલ્વે પોલીસે તેને હજારથી વધુના માલમત્તાની લુંટ ચલાવી હતી. આ દરમ્યાન અન્ય એક યુવાન અહીં આવી પહોંચ્યો હતો અને તેની સાથે લૂંટારુઓએ લૂંટ ચલાવી હોવાનું કહેતા ફરિયાદી વિપુલ સાટીયાએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને એક લૂંટારૂને પકડી પાડ્યો હતો.બનાવની જાણ થતાની સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ પોલીસે ૩ લૂંટારુઓને ઝડપી પાડચા હતા. પોલીસે આ મામલામાં પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ઉપયા ગને શાંતિનગરમાં રહેતા સાદાબ ખાન, ઇમરાન સૈયદ અને ફિરોઝ

અંકલેશ્વર, તા.૨૮ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ

ચાલુ ટ્રેને ચઢવા જતા **ફસાયેલા યુવકનો જીવ બચાવી** હતો. લેવાયો

આરોપીઓની પોલીસે ધરપકડ ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ

પોલીસે ઝડપાયેલા શખસો સામે કાયદેસર કાર્યવાહી કરી

કેટલાક ઈસમો મોઢા પર રૂમાલ સલામત રીતે બહાર કાઢ્યો હતો. બાંધી આવ્યા હતા અને યુવાન આ અંગે મળતી વિગતો અનુસાર ખાતે ફરજ બજાવે છે. યુવાનને પાસે ચપ્પુની અશીએ મોબાઈલ બે દિવસ પૂર્વે અંકલેશ્વર રેલવે ઇજા પહોંચતા તેને સારવાર તેમજ રોકડ રકમ મળી રૂપિયા ૨૫ સ્ટેશન પરથી પસાર થતી જયપુર ખસેડવામાં આવ્યો છે.

ટ્રેને ચઢવા જતા ડેબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે યુવાન ફસાઈ ગયો

આ અંગેની જાણ ટ્રેનના અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પાયલટને જાણ થતા તેણે ટ્રેન થોભાવી દીધી હતી તો બીજી તરફ રેલવે પોલીસના કર્મચારીઓ અને મુસાફરો આવ્યા હતા અને યુવાનને સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ બાદ તપાસ કરતા યુવાન રેલવેમાં જ સિગ્નલ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ભેરુરામ ગેહલોત હોવાનું જાણવા મળ્યું છે.

તે મધ્યપ્રદેશના સામગઢ

સરદાર પટેલ યુનિવર્સિટી સાથે

ભાઈકાકા યુનિવર્સિટીએ વધુ ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. કર્યા

ભાઈકાકાયુનિવર્સિટી, કરમસદ પરિવારોને શ્રી કૃષ્ણ હોસ્પીટલની તથા સરદાર પટેલ યુનિવર્સિટી, આશીર્વાદ યોજના હેઠળ આવરી વલ્લભવિદ્યાનગર વચ્ચે વધુ ત્રણ લેવામાં આવશે. આ યોજના વિકાસ, શિક્ષણ અને તાલીમ, આરોગ્ય સુરક્ષા અને સુવિધાના

સમજૂતી કરાર અનુલક્ષીને થયા છે. તા . ૨ ૫ **આરોગ્ય સુરક્ષા અને** સંચાલિતસરદાર ઓક્ટોબરનાં રોજ ઓક્ટોબરનાં રોજ સુવિધાના ઉપયોગને પુટ લ ભાઈકાકા **સુવિધાના ઉપયોગને** એ જયુકે શન યુનિવર્સિટીનાબોર્ડ લઈને થયા

રૂમ ખાતે સમજૂતી તિવારી વગેરે હાજર રહ્યા હતા.

સરદાર પટેલ યુનિવર્સિટીના વર્ગ ૩ આવી હતી.

વર્ષ માટે સમજુતી કરાર થયા. આ જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે સમજુતી કરાર સંશોધન અને અથવાનિ:શુલ્કસારવારપૂરીપડેછે. બાકરોલમાં પ્રિ-દિવાળી સેલીબ્રેશન યોજાયુ તિરુપ તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ

કે મ્પસ બાકરોલમાં પ્રિ-

. કરાર કરવા માટે કાર્યક્રમનું દિવાળી સેલિબ્રેશનનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાયું હતું જેમાં સંસ્થાના સેંક્રેટરી શીતલ ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પટેલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ડો. અભય ધરમસી, સરદાર પટેલ હતા અને તેમનું અભિવાદન તુલૂસી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કયારાથી થયું હતું. આ ઉજવણીમાં નિરંજન પટેલ, ભાઈકાકા તમામ વ્યક્તિઓએ "પર્યાવરણ યુનિવર્સિટીના રજીસ્ટ્રારડો.જયોતિ બચાવો" પર શપથ લીધા હતા તેમજ તમામ કર્મચારીઓ અને સેવક મિત્રોને એમ.ઓ.યુ.ના ભાગરૂપે ઉપહારસ્વરૂપેભેટએનાયતકરવામાં

અમો નચન શશીકાંત દવે આ જાહેર ચેતવણી પ્રસિધ્ધ કરાવીને જાહેર કરીએ છીએ કે કેટલાક સમય અગાઉ અમારા કેટલાક અગત્યના કાગળો સાથે અમારી સહી વાળો એક્સીસ બેન્ક, મણીનગર શાખા–અમદાવાદનો બચત ખાતા નંબર:-૦૮૦૦૧૦૧૦૦૨૮૪૦૮૦, નો કોરો ચેક નંબર: ૨૪૦૦૯૦ અમારી પાસેથી ખોવાઈ ગરોલ/ગમ થરોલ છે જેની ઘણા લાંબા સમયથી શોદ્યખોળ કરવા છતાંપણ મળી નહી આવતા અમો આ અંગે બેન્કને પણ જાણ કરી અને પોલીસમાં અરજી આપેલી છે. કોઈ व्यक्तित ले चेक मणे अने तेनो हुरઉपयोग करशे तो आ चेक्ने पटावीने अभारी વેરૂધ્ધમાં કોઈપણ પ્રકારની જવાબદારી કે દેવું ઉત્પન્ન કરશે તો આવી જવાબદારી કે દેવાનો અમે સ્વીકાર નથી કરતા અને આવા ચેકનો દુર-ઉપયોગ કરવા સારૂ ઉપજાવી કાઢેલ દેવુ કે જવાબદારી વિરૂધ્ધ અમે અમારો કાયદેસરનો બચાવ કરીશુ અને ચેકનો દુર-ઉપયોગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો અમારો હક્ક અબાધિત રાખીને આ જાહેર ચેતવણી પ્રસિધ્ધ કરાવીએ છીએ.

તારીખ:- ૨૯/૧૦/૨૦૨૪

(नयन એस. हवे)

માંડવા ટોલ પ્લાઝા પાસેનો બનાવ

દુબઈથી સિગારેટ અને લેપટોપની દાણચોરી કરી મુંબઈ લઈ જતા બેની ધરપકડ



અંકલેશ્વર, તા.૨૮

દુબઈથી સિગારેટ અને લેપટોપની દાણચોરી કરી કારમાં રૂા.૧૫.૧૯ લાખનો જથ્થો મુંબઇ લઈ જતા બે ને ભરૂચ પોલીસ ચલાવી રહી છે.

એસ.ઓ.જી.એટોલપ્લાઝાપરથી પકડી લીધા હતા. ભરૂચ એસઓજી પી.આઈ. એ. એ. ચૌધરી અને એ. એચ. છૈયા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી કારમાં સિગારેટનો જથ્થો અને શંકાસ્પદ વસ્તુઓ

લઇ મુંબઇ ખાતે જનાર છે. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.

એસઓજીએ કારમાં સવાર થાણેના ભૂરા મહેલ બિલ્ડીંગ જીવનબાગ ખાતે રહેતો મહેરૂઝ સુલેમાન કુરેશી અને હીનાબેન મહેરૂઝ સુલેમાન કુરેશીની પુછપરછ કરતા અબ્દુલ્લા નામના ઈસમ સાથે મળી એક્સાઇઝ ડ્યુટી ચોરીના હેતુથી ગેરકાયદેસર સ્મગલિંગ કરી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ૫૯૮૦ સિગારેટના પેકેટ અને ૪ લેપટોપ તેમજફ્રોન સહિત રોકડા મળી કુલ ૧૫.૧૯લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારમાંથી પિસ્તોલની ચોરી કરનાર યુવાન ઝડપાયો ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર-૪૮ પર કેબલ બ્રીજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતૂસની ચોરી કરનાર યુવકની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર દેવગઢ બારિયા ખાતે રહેતા નીલ સોની ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર-૪૮ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેબલ બ્રીજના ટોલનાકા પાસે કાર ઉભી રાખી કોઈ કામઅર્થે ગયા હતા આ સમયે તેમની કાર ડેશબોર્ડ પર સ્વ રક્ષણ માટે મુકેલ લાયસન્સ વાળી પિસ્તોલ અને કારતૂસ અજાણ્યો ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ માટે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી જેના આધારે પોલીસે માંડવા ગામ નજીક આવેલ સાંઈ વાટિકા સોસાયટીમાં દરોડા પાડતા મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પ્રિન્સ રાય નામના યુવાનનાં મકાનમાંથી પિસ્તોલ અને છ નંગ કારતુસ મળી આવ્યા હતા.

આથી પોલીસે યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદી સરદાર

Place : Ahmedabad Date : 28-10-2024

DEEP INDUSTRIES LIMITED

કરી કામઅર્થે ગયા હોય કારનો

દરવાજો ખુલ્લો જ હતો તે

६२भियान ने ४२ यूडवी युवाने

પોલીસે ૫૯૮૦

સિગારેટના પેકેટ

જપ્ત કર્યા

ચોરી કરી હોવાનું બહાર આવ્યું

છે. આ મામલાની વધુ તપાસ

અંકલેશ્વર શહેર બી-ડિવિઝન

CIN: L14292GJ2006PLC049371 Registered Address: 12A & 14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380 058. Ph.: 02717-298510 • Fax: 02717-298520 • E-mail: cs@deepindustries.com • Website: www.deepindustries.com **EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS**

	FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30™ SEPTEMBER 2024 (₹ In Lakhs except per share data)					
Sr		QUARTER ENDED		HALF YEAR ENDED	YEAR ENDED	
No	Particulare	30-9-2024	30-9-2023	30-9-2024	31-3-2024	l
		Unaudited	Unaudited	Unaudited	Audited	l
1	Total Income from Operations (net)	13,773.12	11,098.22	27,203.49	46,262.58	l
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	5,129.17	3,793.64	10,038.93	15,220.65	l
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	5,129.17	3,793.64	10,038.93	15,378.70	l
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	4,154.82	2,952.33	8,028.89	12,515.93	l
5	Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss)	4,206.24	3,111.14	8,092.12	12,573.41	l
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]					l
6	Equity Share Capital (Face Value of ₹. 5/- per share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00	l
7	Other Equity	-	-	-	141,125.40	l
8	Earning per share of ₹. 5/- each					l
	(from Continuing and Discontinuing Operations)					1
	Basic (in ₹.)	6.00	4.61	11.79	19.56	1
	Diluted (in ₹.)	6.00	4.61	11.79	19.56	1

The above consolidated financial results of Deep Industries Limited, its subsidiary have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28th October 2024. The statutory auditor have carried out Limited Review of

above consolidated financial results of the Company.						
KEY STANALONE FINANCIAL INFORMATION IS GIVEN BELOW: (₹ In Lakhs except per share data)						
Sr No		QUARTER ENDED		HALF YEAR ENDED	YEAR ENDED	
		30-6-2024	30-6-2023	30-9-2024	31-3-2024	
		Unaudited	Unaudited	Unaudited	Audited	
1	Total Income from Operations (net)	11,898.37	9,577.93	23,862.71	40,787.06	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	3,995.55	3,205.09	8,005.50	13,719.13	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,995.55	3,205.09	8,005.50	13,719.13	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,979.31	2,398.43	6,017.32	10,425.23	
5	Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss)	2,979.31	2,398.43	6,017.32	10,426.95	
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]					
6	Equity Share Capital (Face Value of ₹. 5/- per share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00	
7	Other Equity	-	-	-	122,435.85	
8	Earning per share of ₹. 5/- each					
	(from Continuing and Discontinuing Operations)					
	Basic (in ₹.)	4.65	3.75	9.40	16.29	
	Diluted (in ₹.)	4.65	3.75	9.40	16.29	
1. The above standalone financial results of Deep Industries Limited have been reviewed by the Audit Committee and approved by the						

Board of Directors at its meeting held on 28th October, 2024. The statutory auditor have carried out Limited Review of above standalone financial results of the Company

2. The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and half year ended 30th September, 2024 are available on the Stock Exchnage website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.deepindustries.com).

On behalf of Board of Directors

Paras Shantilal Savla Chairman & Managing Director - DIN:00145639



અંબાજી મંદિર માં દિવાળી ૧ નવેમ્બરે મનાવવામા આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવાશે

આજ થી દિવાળી ના પર્વ ના ધરાવવામાં આવશે જેના વિશેષ દિવસો ની શરૂઆત થઇ ચુકી છે દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે ત્યારે નવા વર્ષ થી શક્તિપીઠો છપ્પન ભોગ અજ્ઞકૂટ બપોરે તેમજ પ્રવાસન ધામો માં યાત્રિકો ૧૨.૦૦ કલાકે રાજભોગ સાથે નો ઘસારો ઉમટી પડશે ત્યારે ધરાવવાનો હોઈ સવારે મંદિર યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ૧૧.૩૦ કલાકે મંગળ કરવામાં મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી આવશે અને ફરી રાજભોગ અને ના પર્વ ને લઇ અંબાજી મંદિર ને અન્નકૂટ ની વિશેષ આરતી સાથે લાઈટ ડેકોરેશન થી શણગારવાની બપોર ના દર્શન નો પ્રારંભ થશે તડામાર તૈયારીઓ પ્રારંભ કરી બેસતા વર્ષે સવાર ની મંગળા ચુકી છે ત્યારે અંબાજી મંદિર નું આરતી ૦૬.૦૦ કલાકે થશે. શિખર ઝાકમજોળ રોશની થી જલ્હળી ઉઠશે, જોકે આ વખતે સવારે આરતી ૦૬.૦૦ થી દિવાળી પર્વ ની તિથિ ની ક્ષતિ ના ૦ ફ.૩૦ કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે એક તરફ ૩૧ ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિર માં દિવાળી ૧ નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી

નવેમ્બરે મનાવવાશે. જોકે નવવર્ષ

ના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી

મંદિર માં માતાજી ની ગાદી તરફ

-ઃ જાહેર નોટીસ ઃ-

નગર રચના યોજના નં.૬૩ (ઈસનપુર-વેસ્ટ)

આથી, જાહેર જનતાને જણાવવાનું કે, નગર રચના યોજના નં.૬૩ (ઈસનપુર-વેસ્ટ)ની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતાં પહેલાની દરખાસ્તો બાબતે યોજનામાં સમાવિષ્ટ જમીન માલિકો,હિતસંબંધ

ધરાવતા તમામ વ્યક્તિઓને અત્રેની કચેરી દ્વારા પ્રાપ્ય સરનામાંઓને આધારે વ્યક્તિગત નોટીસો બજાવીને,

તેઓના વાંધા સુચનો રજુ કરવા જણાવી, સુનાવણીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે, પરંતુ કોઇ

જમીન માલિકો/હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓને સદર દરખાસ્તની નોટીસ પુરતા સરનામાને અભાવે કે

બીજા કોઈ કારણોસર મળેલ ન હોય તો પ્રાથમિક પુરાવા તથા માલિકી હક્કના અધિકૃત પુરાવા સાથે

અત્રેની કચેરીએ રૂબરૂ અથવા લેખિત વાંધા સુચનો આ કચેરીના નીચે જણાવેલ સરનામે દિન-૭ માં રજુ

કરવા વિનંતી છે. તેમ છતાં જો કોઈ રજૂઆત કરવામાં આવશે નહીં તો અત્રેથી લેવામાં આવેલ નિર્ણય જે તે જમીન માલિકોને/હિતસંબંધ ધરાવતી વ્યક્તિઓને બંધનકર્તા રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે.

પાલનપુર તા.૨૮ થી છેપ્પન ભોગ નો અન્નકૂટ પણ

બેસતા વર્ષ ૦૨/૧૧/૨૦૨૪

દર્શન ૦૬.૩૦ થી ૧૧.૩૦ બપોરે અન્નકુટ દર્શન ૧૨.૩૦ થી ૪.૩૦

ત્રીજ થી આરતી સવારે ૬.૩૦ થી ૭.૦૦

દર્શન ૦૭.૦૦ થી ૧૧.૩૦ સાંજે આરતી ૬.૩૦ થી

સાંજે દર્શન ૭.૦૦ થી રાત્રીના

ભરતભાઈ પાધ્યા (ભદ્રજી મહારાજ મંદિર ટ્રસ્ટ) અંબાજીએ

નામ બદલેલ છે

મારૂ નામ મોહમદફહદ ફારૂકભાઈ મનસુરીથી બદલી મોહંમદફહદ ઉમરફારૂક મનસુરી રાખેલ છે. ૨૮૩૪-૨-૩, બાગબાન ગલી, ઢાલગરવાડ, અમદાવાદ.

નામ બદલેલ છે

મારૂ નામ મેહુલકુમાર રતિલાલ શાહથી બદલી મેહુલ રતિલાલ શાહ રાખેલ છે. સરનામું :

145-1-3-B-A, રાધાવલ્લભ કોલોની, કાવેરી ફ્લેટ સામે, મણીનગર, અમદાવાદ.

નામ બદલેલ છે

મારૂ નામ શાહ નિમીષાબેન મેહુલકુમારથી બદલી શાહ નિમીષા મેહુલ રાખેલ છે. સરનામું : 145-1-3-B-A, રાધાવલ્લભ કોલોની, કાવેરી ફ્લેટ સામે, મણીનગર, અમદાવાદ.

નામ બદલેલ છે

મારૂ નામ શાહ પાર્થ મેહુલકુમારથી બદલી શાહ પાર્થ મેહુલ રાખેલ છે. સરનામું : 145-1-3-B-A, રાધાવલ્લભ કોલોની, કાવેરી ફ્લેટ સામે, મણીનગર, અમદાવાદ.

FEDERAL BANK

અમદાવાદ નગર રચના યોજના એકમ-૦૨, ત્રીજો માળ, ઓફીસ નં.૩૧૭ થી ૩૨૨,

મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ,

ક્રમાંક/સંમાનિ/અમદ/૧૦૫૫/૨૦૨૪

નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

કચેરીનું સરનામું :-

પ્રવર નગર નિયોજકની કચેરી,

ફેડરલ બેંક લિમીટેડ, LCRD/અમદાવાદ વિભાગ, દુકાન નં. ૧૦૧, પહેલો માળ, સંગાય આઈપીએલ હારા સેન્ટ્રલ

सिक्योरिटार्एप्रेशन એन्ड रीक्ट्रक्शन ओक् कार्रनाब्शियब એसेट्स એन्ड એन्झिसीन्ट ओक् सिक्योरीटी र्वन्टरेस्ट એक्ट, २००२ ढेंडण આથી જાહેર જતનાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકર્તાઓ અને જામીનદારોઓએ સુચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકતો ફેકરલ **ઠૉક લિમીટેડ** (સિક્યોર્ડ ક્રેડીટર) પાસે ગીરો/ચાર્જ કરેલ છે, જેનો **પ્રત્થક્ષ કળજો** અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. **ફેકરલ** બેંક લિમીટેક (સિક્ચોર્ડ ક્રેકીટર) ની બાકી લ્હેણી રકમ ની વસુલાત માટે તા. **૦૫.૧૨.૨૦૨૪ ના રોજ "જેમ છે ત્યાં" "જેમ છે તેમ" "જે ત્યાં છે"**

ના ધોરણે વેચાણ કરવામાં આવશે, ફેડરલ બેંક લિમીટેડ (સિકયોર્ડ બેંક લિમીટેડ) ની વેચાણની વિગત નીચે મુજબ છે.

અમદાવાદ નગર રચના યોજના

એકમ-૨. અમદાવાદ

oi.	ઉદ્યારકર્તાનું નામ અને સરનામું	બાર્સી લ્હેંશી રકમ	અનામત કિંમત અને ઈએમડી
۹.	(૧). શ્રી દિપન હર્ષદભાઇ છાટભાર અને સહ - અરજદારો : (૨). શ્રી હર્ષદભાઇ એચ છાટભાર, બંનેનું સરનામું : ૧૮, ન્યુ શરદ સોસાયટી, વિજયનગર સ્કુલ ની પાસે, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩ // એ-૮૧, શુભલશ્મી ટાવર, સંઘવી સ્કુલની સામે, અંકુરરોડ, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩.	(રૂા. છાસઠ લાખ છેતાલીસ હજાર નવસો બોત્તેર અને	રૂા. ૪૮,૧૫,૦૦૦/- (રૂા. અકતાલીસ લાખ પંદર હજાર પુરા)

મેલકતનું વર્ણન :- તમામ ભાગ અને હિસ્સા સાથેની સ્થાવર મિલકતનો ફલેટ નં. ૬૦૪, છઠ્ઠો માલ, બ્લોક નં. બી. કાર્પેટ એરીયા<u>ન</u>ું ક્ષેત્રફળ ૭૪.૩૦ સ્કે.મી., વોસ એરીયાનું ક્ષેત્રફળ ૧.૭૪ સ્કે.મી., બાલ્કની એરીયાનું ક્ષેત્રફળ ૨.૪૧ સ્કે.મી. (રેરા એકટ ૨૦૧૬ મુજબ), અવિભાજીત હકક અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૪૬.૦૯ સ્કે.મી., અવધ એલીગેન્સ થી જાણીતી સ્કીમ, જે સ્થિત જમીન (૧). બ્લોક નં. ૨૪૦ (જુનો ફ્લેટ નં. ૧૫૮/૭), (૨). બ્લોક નં. ૨૪૨ (જુનો સર્વે નં. ૧૫૮/૫), (૩). બ્લોક નં. ૨૪૨ + ૨૪૪ (જુનો સર્વે નં. ૧૫૮/૩ અને ૧૫૮/૪), ફાઈનલ પ્લોટ નં. ૯૭, ટી પી સ્કીમ નં. ૨ (બોપલ) મોજે - બોપલ, તાલુકો - દસ્ક્રોઈ, જીલ્લો - અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ જીલ્લો - અમદાવાદ - ૯ (બોપલ), રાજય - ગુજરાત. **ચતુઃસીમા :- ૭ પૂર્વે** : આકાશ રેમ્પ માટે ખુલ્લો, 👁 પ**ક્ષિમે** : કોમન દિવાલ અને કલેટ નં. ૬૦૧ (બી/૬૦૧), ● ઉત્તરે : જગ્યા અને કલેટ નં. ૬૦૩ (બી/૬૦૩), ● દક્ષિણે : ખુલ્લો માર્જીનનો એરીયા.

(૧). અશ્વિન આર ખાવડીચા ઉર્ફે અશ્વિનભાઈ ખાવડીયા S/o સ્શીક્લાલ ખાવડીયા અને (૨). સમતાબેન આર. ખાવડીથા ઉર્ફે ખાવડીથા સમતાબેન આર W/o રશીકલાલ ખાવડીયા, ર**હેલાંક** : એ/૮૧, ૩**૬૮, ગોકુલનગર**, આદીનાથનગર, ઓઢવ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૫૦ // ૫૦૧, બ્લોક -3. ભીમનાથ એપાર્ટમેન્ટ, કાવીશ ડ્રપ્લેક્ષની સામે, ચાંદખેડા, અમદાવાદ - ૩૮૨૪૨૪

(૧). એફએચએસ લોન એકાઉન્ટ નં. ૧૧૫૮૭૩૦૦૦૧ ૬૦૧૪ ની બાકી રકમ રૂા. ૯,૪૮,૮૧૮/- (રૂા. નવ લાખ અડતાલીસ હજાર આઠસો અઢાર પુરા) તા. ૦૫.૧૨.૨૦૨૪ ના સુધી, (૨). હોમ પ્લસ ટોપ અપ ઈકવીટી લોન એકાઉન્ટ નં. ૧૧૫૮૭૬૦૦૦૦૪૦૦૯ ની બાકી રકમ રૂા. ૧૧,૯७,૦૨૩.૫૦ (રૂા. અગિયાર લાખ સત્તાલું હજાર ત્રેવીસ અને પચ્ચાસ પુરા) તા. ૦૫.૧૨.૨૦૨૪ ના સુધી

(૩). ઈ-હોમ પ્લસ પ્રોપટી ટાવર લોન એકાઉન્ટ નં. ૧૧૫૮૭૬૦૦૦૦૪૦૧૭ ની બાકી રકમ રૂા. ૨,૯૯,૯૦૧/-(રૂા. બે લાખ ઓગમ્નએંસી હજાર સાતસો એક પુરા) તા. ૦૫.૧૨.૨૦૨૪ ના સુધી.

31. 24,30,000/-ત્રીસ હજાર પુરા) ₹1. ₹,43,000/-(રૂા. બે લાખ ગેપન

હત્યર તૈકા)

31. 32,30,000/-

ત્રીસ હત્યર પુરા)

મિલકતનું વર્દાન :- તમામ ભાગ અને હિસ્સા સાથેની સ્થાવર મિલકતનો રહેણાંક ફ્લેટ નં. ૫૦૧ (ક્ષેત્રફળ ૪૫ સ્કે.મી.), પાંચમો માળ, બ્લોક -૩ (એલઆઈજી-૩), ભીમનાથ એપાર્ટમેન્ટ ના નામનો એપાર્ટમેન્ટ, બાંધકામ કરેલ જમીનનો ફાઈનલ પ્લોટ નં. ૨૭૦, ટીપીએસ નં. ૨૨, મોજે - ગામ - ચાંદખેડા, તાલુકો - સાબરમતી, જીલ્લો - અમદાવાદ, રાજય - ગુજરાત, રજીસ્ટ્રેશન સબ જીલ્લો - અમદાવાદ -(વાડજ). ચતુઃસીમા :- પૂર્વે : ફલેટ નં. ૫૦૨, પશ્ચિમે : માર્જીન, ઉત્તરે : માર્જીન, દક્ષિણે : જગ્યા અને ફલેટ નં. ૫૦૪.

(૧). મે. એસ એલ્ડ ઢી ઈન્ફ્રાબિલ્ડ પ્રા. લિ. (CIN: U45200GJ2013PTC074021), ખાનગી કંપની, રજીસ્ટર્ડ ઓફિસ : દુકાન નં. ૨૦, સુરભી એવન્યુ - ૩, પ્રાર્થના વિદ્યાલય, ભોલાવ, ભરૂચ, ગુજરાત - ૩૯૨૦૧૫ અને સ**લ-અરજદાર / જામીનદારો** : (૨). શ્રીમતી હિના કેતન શાહ W/o સ્વર્ગ કેતનભાઈ ચશવંતલાલ શાહ, રહેણાંક : ૧૦૧, સુરભી એવન્યુ - ૩, ભોલાવ, ભરૂચ - ૩૯૨૦૦૧, (3). શ્રી પ્રવિણકુમાર કે પટેલ \$/0 **ખેમાભાઈ નારાચણદાસ પટેલ, રહેણાંક** : ૨૫, મુકતાનંદ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, જીએનએફસી ટાઉનશીપની પાસે, ભોલાવ, ભરૂચ - ૩૯૨૦૧૫, (૪). શ્રીમતી શીતલબેન એ ઠક્કર W/o અક્ષયભાઈ ઠક્કર, રહેશાંક : ૧૦૫૭, નારાયણ એવન્યુ, નારાયણ વિદ્યાલય સ્કુલની પાસે, ભોલાવ, નર્મદાનગર, ભરૂચ, ગુજરાત -૩૯૨૦૧૫, (૫). શ્રી જલકુમાર કેતન શાહ \$/૦ સ્વર્ગસ્થ કેતનભાઇ ચશવંતલાલ શાહ, રહેણાંક : ૧૦૧, સુરભી એવન્યુ - ૩, ભોલાવ, ભરૂચ - ૩૯૨૦૦૧, સ્વર્ગસ્થ શ્રી કેતન યશવંતલાલ શાહના કાનુની વારસદારની તરીકે અને (**ક). તુલસી કેતન શાહ S/o** સ્વર્ગસ્થ કેતનભાઈ ચશવંતલાલ શાહ, રહેણાંક : ૧૦૧, સુરભી એવન્યુ - ૩, ભોલાવ,

ભરૂચ - ૩૯૨૦૦૧, સ્વર્ગસ્થ શ્રી કેતન યશવંતલાલ શાહના કાનુની વારસદારની તરીકે

8,59,52,369.24 (રૂા. બગીસ લાખ (રૂા. ચાર કરોડ એકસઠ લાખ બાસઠ હજાર ત્રણસો એકાણું 31. 3,23,000/ અને પચ્ચીસ પૈસા પુરા) (ડીઆરટી - ૨,

(રૂા. ત્રણ લાખ ત્રેવીસ હજાર પુરા) અમદાવાદ સમક્ષ કાઈલ કરાયેલ ઓ.એ.

નં. ૯૭૪/૨૦૨૨ માં દાવાની રકમ મુજબ બાકી રહેલ બાકી) મિલકતનું વર્ધાન :- તમામ ભાગ અને હિસ્સા સાથેનો ફલેટ નં. સી-૩૦૨, સુપર બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૦૨.૦૦ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીનનું ક્ષેત્રફળ ૩૨.૪૫ સ્કે.મી., સોપાન વીર રેસીડેન્સી - ૨ થી જાણીતી સ્કીમ, જે સ્થિત જમીનનો સર્વે નં. ૬૦૯/૧ અને

∉૦૯/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪૯ અને ૧૫૧/એ, ટીપીએસ નં. ૨૨, મોજે - ચાંદખેડા, તાલુકો - સાબરમતી અને જીલ્લો - અમદાવાદ, ગુજરાત. ચતુઃસીમા :- ● પૂર્વે : ઓડાનું ગાર્ડન, ● પશ્ચિમે : કલેટ નં. સી-૨૦૧, ● ઉત્તરે : કલેટ નં. બી-૨૦૩, ● દક્ષિણે : કલેટ નં. સી-૨૦૩. વેચાલના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને ફેડરલ બેંક લિમીટેડની વેબસાઈટ માં આપેલી લિંકનો સંદર્ભ લો એટલે કે :

https://www.federalbank.co.in/web/guest/tender-notices.

દી ફેક્સ્લ બેંક લિમીટક વતી, શૈલેન્દ્ર કુમાર પાન્ડે, એસોસીચેટ વાર્ઇસ પ્રેસીડેન્ટ alo क्वेक्शन अने रीक्परी डिपार्टमेन्ट अमहावाह डिपिઝन (सरकेंसी એक्ट ढेंडण अधिकृत अधिकारी)